



PBP-001-010184

Seat No. _____

B. A. (Sem. I) (CBCS) Examination

November / December - 2018

Geography : Paper - I

(Elements of Geomorphology)

(Elective - II) (Old Course)

Faculty Code : 001

Subject Code : 010184

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

- સૂચના :** (૧) બધા પ્રશ્નો ફરજિયાત છે.
 (૨) જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરો.

૧ ભૂરચના શાસ્ત્રનો અર્થ અને તેના અન્ય વિષય શાખાઓ સાથેના સંબંધો
 સમજાવો. ૧૪

અથવા

૧ પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં લાખાસનો સિદ્ધાંત સમજાવો. ૧૪

૨ ખડકોની વ્યાખ્યા આપી તેના વિવિધ પ્રકારોની ઉદાહરણ સહિત સમજૂતી આપો. ૧૪
અથવા

૨ વેળરનો ખડ પ્રવહનનો સિદ્ધાંત વિગતે વર્ણિવો. ૧૪

૩ જવાળામુખી માટે જવાબદાર કારણો તેના પ્રકારો અને વિવિધ વિતરણ
 પર નોંધ લખો. ૧૪

અથવા

૩ સૂર્યમંડળ પર ભૌગોલિક અહેવાલ લખો. ૧૪

૪ ગેડીકરણ એટલે શું ? તેના વિવિધ પ્રકારો સમજાવો. ૧૪

અથવા

૪ ધરતીકુંપ થવાના કારણો, અસરો અને તેની સંભવિત વિસ્તારોની માહિતી આપો. ૧૪

૫ નોંધ લખો : (કોઈપણ બે)	૧૪
(૧) ભૂસ્તરીય યુગો	
(૨) પૃથ્વીની આંતરિક રચના	
(૩) પર્વતોના પ્રકારો	
(૪) પૃથ્વીની આયુ	

ENGLISH VERSION

Instructions : (1) All questions are compulsory.
 (2) Draw neat diagram wherever necessary.

- 1 Explain the meaning and the relation of other subject 14
 branches of geomorphology.

OR

- 1 Explain the theory of Laplas regarding the origin of 14
 the earth.

- 2 Define rocks and discuss their various types with examples. 14

OR

- 2 Describe Vegner's continental drift theory in detail. 14

- 3 Write note on the responsible reasons for the origin types 14
 and world distribution of volcanoes.

OR

- 3 Write a geographical note on solar system. 14

- 4 What is folding ? Explain its different types. 14

OR

- 4 Give information of reasons, effects and the possible 14
 regions (earthquake prone zones) of the earthquake.

- 5 Write notes on : (any two) 14

- (1) Geological Eras
- (2) Interior structure of the earth
- (3) Types of mountains
- (4) Age of the Earth.